

## સ્વરાજ્યને છું વર્ષે

[ ૨૫ ]

**ખિટિશ અમલ હતો** ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજ્ય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેનો અર્થ શો એ સમજું દેવું જોઈએ. સામાન્ય પ્રણાલી, અમન્દાર વર્ગ, રાજ્ય કરતો કે સત્તા ભોગવતો વર્ગ અને મૂર્ખદાર વર્ગ-એ અધ્યાત્મા અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમ જ ધાર્યાં કરે તેવો અવાજ ખિટિશ સત્તાનો હતો. ખિટિશ અમલ જેમ જેમ સ્થપાતો ગયો તેમ તેમ તેનો કઢ્ય અનેક રીતે વધારે ને વધારે ભેસતો ગયો. ખિટિશરો સામનીતિથી કામ કેતા, દામચી પણ કામ કેતા, બેદીનીતિ તો તેમના લોહીમાં વણુંશેલી રહી છે; પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંનીતિ એટલી બંધી સખત હતી કે જ્યાં ડેઈએ સહેજ વધારે પડતું માથું જિયકર્યું કે એ મૂંઝો જ પડયો છે. શરદ્યાતમાં પોતાની સ્વર્ઘાંદ સત્તા ઉપર અંકુરોની સુકાયા તેથી ધણ્ણા નાના મોટા રાજસ્યો, સામતો કે જમીન-દ્વારોએ માથું જિયકર્યું, પણ તેમને એવી રીતે લોંખભેગ ડરવામાં આવ્યા કે બીજાનોની સાન આપોઆપ ડેકાણે આવ્યો. શરદ્યાતમાં પોતાના ધર્મવર્તુલોમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધાર્યાથી ડેટલાં ધર્મગુરુઓ અને મહતોએ પણ ખિટિશ સત્તા વિસ્તૃદ્ધ ડિલિયાન કરી, પણ છેવટે શાણ્ણા ખિટિશરોએ તેમને અસ્થિત્વન આપ્યું કે ધર્મકર્મની આખતમાં રાજ્ય ડાથ નહિ નાખે. તેથી વધા જ ધર્મપંથના આગેવાનો નિર્બધ બની ગયા, તેમ જ ખિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પોપક પણ અની ગયા. બ્યાપારી તેમ જ બીજો મૂર્ખદારવર્ગ એ માત્ર પોતાની કમાણ્ણી દૃઢ્યતો. તેમને પણ વિદેશી માલના દ્વાલ થવાનું નહું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિસ્તૃદ્ધ કહેવાનું ડેઈ ન રહ્યું. આ રીતે આખા ખિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભાણેલ અને વગસગ ધરાવનાર આખો વર્ગ જણે હરિને કામ એઠો. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેલું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતો અથવા નામભાગનાં હતો, તે વર્ગના અસતોપને વાચ્યા આપનાર પ્રથમ તો ડેઈ હતું નહિ; અને જ્યારે વાચ્યા આપનાર વર્ગ જીબો થયો અને વધતો ગયો ત્યારે પણ એનો અવાજ બહુ ધીરો અને અરપણ

હતો. તેથી, એક રીતે જાણે કે, આપો દેશ સંતોષી અને સુખી હોય એવો લાસ થતો. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ ભાનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હોય, વિશાળ પ્રમાણુમાં શાન્તિ દેખાતી હોય તારે પણ લોકો એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તો એનો અર્થ એમના મનમાં હાડે હાડે શે હોવો જોઈએ એ જાણવું ઘટે છે.

વિચાર કરીશું તો જણ્ણાણે કે ‘સ્વરાજ્ય નથી’—એનો અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આપી પ્રજને પોતાનું યથાર્થ દુઃખ રણૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજના એકએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રણૂ કરવાની તક ન હોય તાં લગી તંત્રવ્યવસ્થા અને ભાવાપીવાનું સુખ હોય તોપણ લોકોને ગુંગળામણું થયા સિવાય ન રહે. મનતી વેદા મનમાં જ સમાવવી કે અધ્યરી અને વિકૃત રીતે રણૂ કરવી એ જ સ્વરાજ્યનો અભાવ અગર તો પરરાજ્ય. જ્યારે ભાથા ઉપર એવા લય અભૂતતા હોય કે ગરીબ અગર તવંગર એરેઝરી વાત તદ્દન ફૂઠથી અમલદારો સમક્ષ કઢી ન શકે અગર ઉરતો ઉરતાં અને તે પણ કારોક જ કહેવાની— અને તે પણ પરાભાસમાં પર દારા કહેવાની—તક મુસેકીલીથી મેળવી શકે, તારે સૌને સ્વરાજ્ય નથી એવો લાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજ્યના અભાવની કે પરરાજ્યના પ્રભાવની ભાગી વેદનાએ જ છેવે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવે ર૧૯૪૭ના ઓગસ્ટ ૧૫મી તારીખે ગાંધીજીના પ્રેમણ જીવન દરમિયાન જ પ્રેમણ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિનો ઉત્સવ પ્રણાયે જિજાવ્યો. અહીંથી સાવ નવો યુગ શરૂ થાય છે.

**પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્ય :** એ એ રિથતિનું અંતર કોઈ એક જ બાધતમાં નથી સમાતું. અનેક બાધતો એવી છે કે ને દારા પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજ શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં લોકો પોતાના હિલનું દરદ પોતાની જ્યાનમાં સીધેસીધું અમલદારો સમક્ષ ને નિર્ભાતાથી રણૂ કરી ન શકતા તે રણૂ કરવાનો સમય તેમને લાગ્યો. સ્વરાજ્ય મહ્યા પણે અનેક સ્થાપિત વર્ગોના બાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમણે રાજ્યાં, સામનો, જન્મનિદારો વગેરે, વળી અનેક ઇન્ડિયુસ્ટ્રી ભાનસ ધરાવતાર ધર્મપંચના અય્યસરોની સ્વચ્છાંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે

પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગડ્ડો જમાવી એડેલો એવા અનેક અમલ-દારોનો અમલશાહી ઉપર પણ તરાય પડી. આ બધું છતાં લોડા તો એમ જ માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાળુથી લોડાની એવી પણ ફરિયાદ છે કે ખિટિશ અમલ હરભ્યાન હતી તેવી તંત્રચ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને અણી બાળુથી લોડા સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તો માને જ છે. લારે લોડાના મનમાં સ્વરાજ્યનો અર્થ જે હોવો જોઈએ તે ૨૫૪૮ થાય છે અને તે અર્થ એટલે પોતાનાં દુઃખદરદ સરકાર સમકા રજૂ કરવાની પૂરી અને નિર્બિંદુ તક.

સ્વરાજ્યનો આ અર્થ એ તો એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફરિયાદ થતા અને તેમાંથી સિદ્ધ કરવાના બીજા અનેક અર્થો, જે પ્રણાની દુઃખદરદની ડાઢાણી પ્રગટ થયા પછી ફેમેડમે ધ્યાન ઉપર આવે છે તે અર્થો, પૈકી એક અર્થ એ છે કે પ્રણાની અગવડો પૂરેપૂરી સમજવાની ડાશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ ડાશિશ કર્યો પછી તરિત ગતિએ સરકારે એવાં સંગીન પગદાં ભરવાં કે જેથી પ્રણાની ફરિયાદે એઠાં થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રણાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં હિલ જીતવાં અને તેનો સહયોગ મેળવવો. એથો અર્થ એ છે કે સરકારી તંત્રમાં ડાઈ પણ જીતનો સહો ન હોય, લાંઘુસ્વલ ને લાગવળનું પ્રમાણ ન જ હોય યા નામભાત્રતું હોય. પાંચમો—સૌથી મહત્વનો અને છેલ્દો—અર્થ એ છે કે પ્રણાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચોવી અમારે માથે બેસનાર ડાઈ નોકરશાહી નથી, પણ પોતાનો અનિવાર્ય જરૂરિયાત પૂરતો અછોં લઈ અમારી જ સેવા અર્થે નીકલેલ એક સમજું ને આપલોગી સેવકાનું અનેલું તંત્ર છે.

૧. સરકાર પ્રણાની અગવડો સમજવાની ડાશિશ નથી કરતી એમ ડાઈ પણ કહી શકે નહિ. અદ્યાત્મ, સરકારી તંત્ર ચલાવનાર જે સંઘાધ્ય માણ્યસો છે એ અધ્યા સમાન યોગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ ડાઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માણ્યુથી પ્રણાની રહે જ; સરકાર પણ છુંચે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રણાનાં દુઃખદરદો જાણવાની ડાશિશ કરે છે એ અર્થમાં તો સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ ડાશિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અશે સ્વરાજ્યનો એ અર્થ પ્રણાને મન સિદ્ધ થયો નથી. અને એ બાધ્યતમાં શું છાપાં

કે શું જવાખદાર કાર્યકર્તા કે શું જીંચા હોદેદાર અમલદારો—એ અધા જ એકસરભી ફરિયાદ કરતા જાણ્યાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના અધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણ્યાની ઘટે. નહિ તો જે વર્ગ આગળ પડતો, વાચાળ અને છાપાંચો પર કાખૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને ખીંચ વર્ગો બખડતા રહી જાય અને કલા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તો આ કરતાં પરરાજ્ય સારું હતું, તો એને હોથ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જે પ્રજાના દિવભાં અને તેના એકેએક વર્ગના દિવભાં હ્સાવવું હોય તો સરકારના નાનામોદા અધા અમલદારોએ સહાતુભૂતિથી પોતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તેવો અધાલ પ્રજાની અગવડ સમજવા રાખવો જ પડશે, નહિ તો કઢી જશ મેળવી શકશે નહિ.

૨. પ્રજાની અગવડો કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડો જાણે તો પણું સવાલ એ જિલો થાય છે કે તેને નિવારણ તે શું કરે છે? અને જે કરે છે તે જડપથી કે દીર્ઘસુનિતાથી? આનો જવાખ સરકારપણે સંતોપમદ છે જ નહિ. અસાર લગીનો પ્રજાનો જ નહિ, પણ જવાખદાર અમલદારો અને નેતાઓનો પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મોડી પડે છે તેના કરતાં તેનું નિવારણ કરવામાં વધારે ઢીલ કરે છે. ઓક્ટેન દરદ જાણ્યા પછી દર્દીને દવા આપવાનું કહે, પણ જો તે દવા આપવામાં મોડું કરે તો એણે દરદ જાણ્યું ન જાણ્યું ખરાખર છે. એક અતિ જિચ્ચે કદ્દાના સ્વર્ગવાસી દેશનેતાએ ચોમાસામાં પડું પડું થઈ રહેલ મડાનમાં વસ્તાર પોતાના અધીન નોકરને કલ્યું કે હિકર ન કર, મડાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મડાન છેવટે પડી ગયું ને એ નોકરના કુટુંબનો એક સભ્ય દ્વારા મૂલ્યો લારે તે પ્રામાણ્યિક નેતાને વખતસર કામ ન કર્યાનો ઊડા ઐદ રહ્યો, અને પેલા વદ્ધાર નોકરનો વિશ્વાસ તો હભેશ ભાટે ગુમાંયો. સરકાર વિશે જો લોકો એમ ધારતા થઈ જય કે આ તંત્ર નવાણી છે તો એથી વધારે તુકસાન સરકારપણે ખીંચ એક્ષિય હોય શકે નહિ. અમલદારો પોતાના કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારણ જરૂર પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડો જાણ્યા છતાં તેને નિવારણાની વિરોધ હિકર સેવતા ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દર્શિયે એમ કહેવાનો હક્ક છે કે તેઓ પ્રજાદોડી છે; કેમ કે પ્રજાનું અનુ ખાઈ

तेनी सेवार्थे नीकणवानो द्वावा करवा छतां तेच्चो ते दावाने वक्षादार नथी रहेता. एटले झुपथी अमल करवानी दृष्टिमे तो सरकार उपर ज खी ज्ञापदारी आवी पडे छे. अत्यार लगीनो अनुबव कहे छे के झुपथी कामधनुखानी आवउत सरकारी तंत्रमां नथी. स्वराज्यने छहु वर्षे आ आरोपभांथी मुक्त थर्छ सरकारी तचे नवेसर भातरी करी आपवी ज्ञेधिमे के शहआतनां पांच वर्ष शिखाउपखानां हतां. हवे अनुबव डीक थयो छे, एटले तंत्रमां हीलाश नहि ज होय.

३. पछेकां, १८३७मां ज्यारे आंतिक स्वराज्य भएयुं त्यारे, गांधीज खवा भिनिस्टरीने कहेता के तमे भाज ओडिसमां ज अने तेना दृतरेमां भराई न रहे. लोडेमां ज्यो, विश्वास भेणवो. गांधीजनुं आ कथन डेखुं महरवतुं छे ते अत्यारे तो ववारे स्पष्ट थाय छे. डेन्हना अने प्रान्तना भंत्रीयो अने भीज राज्यप्रमुख ज्येवा भोया होदेश्वरो सामान्य जनतामां डेटले अंशे भगेहले छे एम ज्ञे डाई पूछे तो अनो उतर छापा अने लोडे एने ज आपे हु तेच्चो अनेक जनता उद्घाटन समारंभोमां अने भीज ग्रसंज्ञामां लोडा चामे आवे छे अने साधारण्य लोडा तेमना भोढां ज्येवा पामे छे. आ वस्तु स्वराज्यना मूणमां ज धा करनारी छे. एक तो वांचवा लभवा अने फळियानो उथलाववामां ज भुद्धिशाणी भंत्रीयोनी शक्ति एक्स्ट्री खी अरव्याई ज्य छे के पछी तेमनी हैयाउक्लित बहु ज धटी ज्य छे. ज्ञे दृक्ष खातानो भंत्री चोताने लागतावणगता प्रेषा परत्ने चोताने अधीन ग्रहेशमां ज्ञते ज्ञालोडाने भगे, तेमना भोटेथी सीधी वात सांबगे अने तेमनी साथे वातचीत करे तो लोडा ज्ञर एम समजवानाके सरकार आपखी छे. ज्यारे गोराओ हता त्यारे तेच्चो कही भगता नहि, भगे तो तुआय एटलो खधी डे तेमने भगवुं एटले हेवाने भगवुं एम लोडा समजता. ज्ञे आने पछ्य लोडाना दिलमां आ ज धारणा चालु रहे तो एथी वधारे खूरुं भीजुं होय न शडे. मानसशाखनी दृष्टिमे ज्ञवनमां सौधी वधारे महत्व सहानुभूतिनुं छे. वैद डे परियर्थी करनार नर्स ज्ञे पूरेपूरी सहानुभूतिवाणां होय तो दरद न भट्या छतां, अने धर्षियार ते धर्ष्यानुं लान होवा छतां, दरदी एमता ग्रह्ये जांडी भमता सेवे छे. तेने एम थाय छे के वैद अने नर्स साच्चा छे, छेवे दरद्नुं भट्युं न भट्युं ए तो भगवानने आधीन छे. दरहानी आवी लागली एने ज साच्चा वैद अने साच्ची नसनी विज्य छे. ज्ञे आ अनुबव साच्चो होय तो ए ज न्याय प्रज्ञ अने सरकार वन्ये.

લાગુ પડે છે. સરકાર માત્ર એમ કલા કરે છે કે પ્રજનનો સહયોગ જોઈએ, તે પૂરો સહયોગ નથી આપતી, ધર્યાદિ...પણ એણે વિચારથું જોઈએ કે પ્રજનનમાં સહયોગ કરવાની પૂરી લાગણી તે ડેમ પ્રગટ્યાની શકી નથી? જે તે સાચા હિલથી આ વસ્તુ ઉપર વિચાર કરેતો તેને પોતાને જ પોતાની ખામી જણ્ણાશે. પ્રજનને ગાંધીજી પ્રત્યે ભમતા હતી, પ્રજન તેમને દ્રેક આપતમાં સહયોગ કરતી. એનું હાઈ તપાસીશું તો જણ્ણાશે કે ગાંધીજી તો પ્રજનના અદનામાં અદના માણુસને પણ શૃંખળી મળવાનો અને તેની કથની સાંલળવાનો અવસર આપતા. શું, આજે કોઈ સરકારી હોદેદાર એમ કહી શકશે કે પ્રજનની સહાતુલૂતિ મેળવવાનો આ કીમિયો તેને લાગ્યો છે? આજે પણ જે ગણ્યાગાંધીચા સેન્ટડેનેશના કોઈ ને કોઈ લાગમાં અને કોઈ ને કોઈ પ્રજનના થરમાં પૂર્ણ રીતે ખૂબ્યા છે તેમનો અનુભવ પણ એ જ કહે છે કે લોકસંપર્ક એ જ લોકનો સહયોગ મેળવવાની ચારી છે. શું રવિશાંકર અહારાજ કે શું સંતાપાલ કે શું સ્વામી આનંદ—એ બધાને પૂર્ણ તો એક જ વાત કહેશે કે લોકાંતો તો સાન ભોગા છે, કહેા તે કરવા તૈયાર છે; ફરત તેમનાં હિલ કુતવાં જોઈએ, ને તે તો સંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારો આ વસ્તુ ભાગ્યે જ જણ્ણે છે અને તેથી જવાબદાર લોકાંગેવાનો પણ તેમના ઉપર આક્ષેપ મૂક્તાં પાણ નથી પડતા કે તેમને તો વાલકેશ્વરની અગદ નવી હિલ્લીની હવા જ ખાવી છે. પોતાની મુસ્કૃતીઓએ હુર નહિ થઈ હોય તોપણ જે પ્રજન એવો અનુભવ કરે કે સરકારી અમલદારો તેમની વાત ધીરજથી સાંલળે છે. તો તેને બાહુ ઇરિયાદ વિના મુસ્કૃતી સહન કરવાનું બળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને નેવો તેવો લાભ નથી.

૪. સરકારી તંત્રમાં લાંઘસુસ્વલ્પ અને લાગવગ ડેટલા અમાણુમાં છે એનું પ્રમાણું આપવાની જરૂર જ નથી. એક એક આતામાં એક એક મંત્રી, એને આધીન ભીજા ડેટલાએ ઉચ્ચ અમલદારો, તેમાં પણ આઈ. સી. એસ. એવા હોદા ધરાવનારા—આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મેરોલાંગ દેશપરદેશમાં ઇરેલા. તેમનો રુચાય અને દમામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણુસ તો એમની ઝુદ્ધિ, એમનાં ભાણુતર વિશે સાંલળાને જ આભો થઈ જાય. છતાં આપણે જોઈએ છીએ કે એમાંથી હજુ સુધી તો એક પણ માઈનો લાલ એવો નથી નીકલ્યો કે જે સરકારી તંત્રના મુખ્ય સરાને હુર કરવાની કોઈ જરીબુદ્ધી બતાવી શકથો હોય. આવી સ્થિતિમાં શૃંખળી ઇરિયાદ કરવા પૂરતું સ્વરાજન્ય પ્રાપ્ત થયા બાદ જે લોકા એમ કહ્યા

કરે કે સરકારી તંત્ર ઉપર આવનાર અમલદારો અને નોકરો લાંચની બદીથી સુકા નથી અને લાગવગ એ તો તેની ભૂમિકા છે, તો પ્રજાને દોષ હઈ નહિ શકાય. મોટા મોટા વ્યાપારીઓએ લોભવણ પ્રણાદોહ કરી સરકારને હોય તો એ સમજ શકાય, પણ ડેટલાક સરકારી હોદેદારો જ સરકારને હોય તો એ મહેસુસ રેતી ઉપર જાઓ છે એમ કાઈ પણ કહી શકે. જેણોએ સરકારને ધોખો આપ્યો હોય—પછી તે વ્યાપારી હોય કે અમલદાર—તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલો જ લોકનો ઉઠળાટ વધે છે; અને બીજુ આનુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાઈ આદૃત આવશે તો જોયું જરૂરો, કેમ કે તેમને નથી હોતો તરત શિક્ષા થવાનો લય, કે નથી હોતો સખત નસિયત થવાનો લય. કરોડોના જોણાણ કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુધે શા માટે જીવા જોઈએ? તેમણે છેવટે તો પ્રણતું જ લોહી થૂરચું છે; અને લોહી ચૂસનાર ને એક પણ માણુસને ઝડી ખાનાર જંગલી પ્રાણી જો જોળીતું નિયાન ભનાતું હોય તો આવા જિજણા દેખાતા વ્યાપારીએ અને અમલદારો, જે આખી પ્રણતું રીતી કે આડકતરી રીતે લોહી પીતા હોય, તેણો તુરતાતુરત સખત સંજને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સરો દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કંદે નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તો અમલદારો ન લોભાય. પ્રજા અભયનું છે, અસરકારી છે, રિસ્ટાફન્ડ નથી, એમ સમજને જ તો સરકાર ચાલે છે. એટલે એણે પોતાના તંત્રને વહેલામાં વહેલું સહસુકા કરવા તરફ જ લક્ષ આપવું બટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સહાની ફરિયાહે બિટિશ અમલના સરાને ભુલાવી હોયાં છે.

૫. આજે પ્રજા એમ તો જાણે છે કે રાજ્યકર્તાં અમારા જ લાઈએ છે ને અમારામાંથી જ તેણો અમારી સંગ્રહિતી આગળ આવ્યા છે; પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજ રહી છે કે હોદેદારો—ખાસ કરીને મોટા હોદેદારો—જ પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શાલે તેવો છે. જે મેંઘવારોતું બહાતું આગળ ધરવામાં આવે તો પ્રજા એમ કહે છે કે મેંઘવારી તો સૌને છે. વળી સામાન્ય પ્રણાજન કરતાં અને સાધારણ ડાટિના સરકારી નોકર કરતાં જાંચી ડાટિના અમલદારોને પોતાના તંત્ર વિશે અને પોતાના જીવન વિશે વધારે આત્મઅન્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કરોણ સંગ્રહ નહિ કરીએ તો પણ કહી ભૂખે મરવાના નથીકે અમારાં બાળબન્યાં હેરાન થવાનાં નથી. જે તેમનામાં આવી જાંડી શક્ષા ન હોય તો સહેલે જ તેમનાં મન પગારના ધોરણું પરતે ઢીલા રહેવાનાં અને જેટલું મળતું હોય તે પણ

ઓછું લાગવાનું. એ તો ચુવિહિત છે કે સરકારી તંત્રવાહીમાં ડેટલાક એવા અવસ્થ છે કે જેમને પૈસાની લેશ પણ પડી નથી; જીલ્ડિં આપભોગથી કામ કરે છે, પણ એવાઓની સંખ્યા નજીવી છે. અને વહીવરી અર્થના આંકડા તેમ જ પગારનાં ઘેરણે જેતાં એમ લાગે છે કે આટલો એને હવે પ્રણ જિયકી શકે તેમ છે નહિ. છે તેટલા વેરા પણ પ્રણના મોટા ભાગને શુણ જેવા લાગે છે, તેમ છતાં નવા નવા વેરાની વાતો આગળ ધરાતી જ જય છે. આ સ્વર્યવે છે કે સરકારી તંત્ર કરકસરના તત્ત્વને જાણું નથી. જે રાજ્ય પોતાની આવક કરતાં વધારે અર્થ કરે અને ૮૦-૮૫ ટકા જેટલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના એનાને સમજી ન શકે તે સ્વરાજ્ય છે એમ તો ખરા અર્થમાં ન કહી શકાય. જો ડાઈ પણ રીતે તંત્રનો અર્થ નભાવવો હોય તો એના દેખોતા ત્રણ માર્ગો છે : (૧) મોટા પગારો ઉપર કાપ મૂકવો ને બીજી ધણી બાયતમાં સરકારે કરકસરનું તત્ત્વ દ્વારા કરવું. (૨) મોટા મોટા ઉદ્ઘોગપતિઓની આવકમાંથી વધારે મેળવવું. (૩) શાલ કે બીજી હરડેઝની વારસાગત અસુક ભિલકતથી વધારે ભિલકત હોય તો તેમાંથી હિસ્સો મેળવવો. ગમે તે રીતે સરકાર ખાંધ પૂરી કરે, પણ તેનો એને મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ પર તો ન જ પડવો જોઈએ. ગામડાંનું હીર જરા પણ ન સુસાય, જીલ્ડિં તેનું તેજ પોથાય એ રીતે જ પૈસા મેળવવાની કરામત નાણુંપ્રધાનોએ વિચારવી જોઈએ. જે આમ ન બને તો પ્રણ એમ કહી નહિ માને કે સરકારી તંત્રને આપભોગી સેવકો મળ્યા છે. જે પ્રણનો એ અંસોટ હશે તો પણ સામ્યવાદ, સમાજવાદ કે બીજી એવા ડાઈ વાહને ખાળી નહિ શકાય. એ જુદી વાત છે કે તે વાદ આનીને પ્રણનું ડેટલું દીનું કરશે ? પણ એક પકડમાંથી જીલો થયેલો અસોટ સ્વાલ્લાખિક રીતે પહુંં અફલવા ભાણુસને પ્રેરે છે. તેથી આપણે સ્વરાજ્યને છુટે વર્ષે આશા રાખીએ કે જેણો લાંબા વખતથી સેવા આપતા આવ્યા છે, જેણો ગાંધીજીના જીવન માર્ગને થોડા પણ સમજે છે, અને જેણો પ્રામાણિક છે તેણો ગાંધીજીની સ્વરાજ્ય-કલ્પનાને પોતાની હ્યે પણ મૂર્તિમંત કરે.

—પ્રસ્થાન, એપ્રિલ ૧૯૫૨.